

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં શહેરની માલિકીની સગવડોમાં ભાડુઆતો અને નફો ન કમાતી સંસ્થાઓને ભાડામાં રાહત આપશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 1, 2020) – આજે, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) ઘોષણા કરી કે સીટી ઓફ બ્રેમ્પટન શહેરની 41 સગવડોને આવરી લઈને નાના ધંધાઓ અને નફો ન કમાતા ભાડુઆતોને ભાડામાં રાહત પૂરી પાડશે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, COVID-19 નો ફેલાવો રોકવામાં મદદરૂપ થવા, શહેરની તમામ સગવડો આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી બંધ રહેવાની છે. આ અજોડ અને પડકારભર્યા સમયને લીધે, સીટીની સગવડોના ભાડુઆતો છે તેવા ધંધાઓ અને સંસ્થાઓ પર પડનારા આર્થિક પ્રભાવને સીટી જાણે છે.

સીટી કર્મચારીગણની ભલામણના આધારે, સીટી નફો ન કમાતા અને નાનો નફો કમાતા ભાડુઆતો માટે ત્રણ મહિના સુધી ભાડુ ચૂકવણી હાલ પૂરતી ટાળશે અને તે પાછળથી ચૂકવવાનું રહેશે, અને નવા ફેડરલ (સંઘીય) કાર્યક્રમોની પહોંચ મેળવવામાં અસમર્થ નફો ન કમાતા ભાડુઆતો માટે 3 મહિનાના સમયગાળા સુધી ચૂકવણીઓ માફ કરશે. આ રાહતથી શહેરના 81 માંથી અડધાથી વધારે ભાડુઆતોને સહાયતા મળશે.

શહેરના ભાડુઆતોની હાલની સ્થિતિના સંદર્ભમાં, કેટલાકને બિન-અનિવાર્ય ધંધાઓને પ્રતિબંધિત કરતા પ્રોવિન્સના હુકમને લીધે શટડાઉન કરવાની ફરજ પડી છે, જ્યારે અન્ય લોકોએ શારીરિક અંતર જાળવવાના આચરણને વળગી રહેવાનું પસંદ કર્યું છે.

કાઉન્સિલ આ નિર્ણય પર માહિતી કાઉન્સિલની એપ્રિલ 8 નાં રોજ યોજનારી બેઠકમાં એક અહેવાલમાં મેળવશે.

સીટી બ્રેમ્પટન રહેવાસીઓને માહિતગાર રાખવા કટિબદ્ધ છે અને સીટીની COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં અદ્યતન માહિતી ઉપલબ્ધ થાય એટલે માહિતી પૂરી પાડવાનું ચાલુ રાખવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયો પર અને COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સમુદાયને સહાયતા કરવા સીટીના પ્રયત્નો પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/COVID19 અથવા Twitter, Facebook અને Instagram પર [@CityBrampton](https://twitter.com/CityBrampton) ને અનુસરો.

ઝડપી હકીકતો

- હાલમાં, શહેરમાં 41 સગવડોને આવરી લેતા સીટીમાં 81 ભાડુઆતો છે.
- હાલમાં, સીટી \$302,134.68 માસિક ભાડુ એકઠું કરે છે. સીટીની માલિકીની ઇમારતોમાં નફો ન કમાતી બધી સંસ્થાઓ માટે ત્રણ મહિના સુધી ભાડુ માફ કરવામાં સીટીને \$202K નો ખર્ચ થશે.
- હાલમાં, સીટી કોઈ ભાડાની જગ્યામાં પ્રતિબંધિત પ્રવેશ ધરાવતું નથી અને ભાડુઆતોને જાણવું છે કે તેઓ પોતાની કામગીરી ચાલુ રાખવા ધારે છે કે કેમ તે તેઓનો પોતાનો નિર્ણય રહે છે, કારણ કે સીટી પ્રવેશ પૂરો પાડવાનું ચાલુ રાખશે જો જરૂરી હોય. જોકે, હાલના અને અજોડ સંજોગોને ધ્યાનમાં લેતા, કેટલાક ભાડુઆતોએ શટડાઉન સમયગાળા દરમિયાન ભાડામાં રાહતને સંબંધિત પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે.

અવતરણો (ક્વોટ્સ)

“આપણાં નાના ધંધાઓને અને નફો ન કમાતી સામુદાયિક સંસ્થાઓને ટેકો આપવો એ આ મુશ્કેલભર્યા આર્થિક સમય દરમિયાન નિર્ણાયક બની રહે છે. સીટી હોલ અને સીટીની સગવડો આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી બંધ રહેશે ત્યારે, સીટીએ અમારી વિકેતાઓને ચૂકવણી 30 દિવસને બદલે 14 દિવસની કરી દીધી છે. આજે, અમે સીટીના નફો કમાતા અને નફો ન કમાતા નાના ભાડુઆતોને ભાડામાં સીધી રાહત આપવા વધારાના પગલાઓ લઈ રહ્યાં છીએ જેથી કરીને અમે આ સમૂહો અને નાના ધંધાઓને સહાયતા કરી શકીએ છીએ જે બ્રેમ્પટનના સમુદાયને એકબીજા સાથે સારી રીતે સંવાદ આપવે કરવા માટેના અલંકાર તરીકે મહત્વનો ભાગ છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આ શહેર 41 ઉપરાંત સીટીની સગવડોમાં આપણાં નાના ધંધાઓ અને નફો ન કમાતા ભાડુઆતો માટે સહાયક ભાગીદાર બન્યું છે. સીટીની સગવડો પ્રોવિન્સના અને પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે બંધ રહે ત્યારે, સીટી એ ધંધાઓ અને સંસ્થાઓને રાહત પૂરી પાડી રહ્યું છે જે, અન્ય સંજોગોમાં, સીટી માટે આવક કમાવાનો મદદગાર સ્ત્રોત છે. આજની ઘોષણા COVID-19 દરમિયાન તેઓની અવિરત ધંધાકીય જરૂરિયાતોને ટેકો આપે છે, અને અમે આગામી મહિનાઓમાં સહયોગ સાધીને તેઓ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

“હવે પહેલાં કરતા વધારે, નિર્ણાયક બાબત એ છે કે આપણો સમુદાય COVID-19 નાં પ્રભાવો સામે સૌથી વધારે સંવેદનશીલ લોકો માટે સુરક્ષિત, સહાયક સ્થળ પૂરું પાડવાનું ચાલુ રાખે છે. આજની ઘોષણા પીલની બોયઝ એન્ડ ગર્લ્સ ક્લબને તે કરવામાં મદદરૂપ થાય છે. હું સીટી ઓફ બ્રમ્પટને અને કાઉન્સિલે આ સમય દરમિયાન બ્રમ્પટનના જુવાનો માટે પૂરી પાડેલી અવિરત સહાયતા અને દેખાડેલી કરુણા બદલ તેઓને મારા હાર્દિક અભિનંદન પાઠવવા અને તેઓની કદર કરવા ઇચ્છું છું.”

- માર્કલ જે. ગ્યોવેઈ (Michael J. Gyovai), એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર, બોયઝ એન્ડ ગર્લ્સ ક્લબ ઓફ પીલ

“સ્પોર્ટફિક્સ (SportFix) બ્રમ્પટનને 30 ઉપરાંત વર્ષોથી પોતાનું ઘર બનાવ્યું છે, અને આપણાં આરોગ્યપ્રદ અને સક્રિય સમુદાયને વ્યવસાયી રમતો સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. સાઉથ ફ્લેચરના સ્પોર્ટ્સપ્લેક્સ સ્થિત અમારું ગૃહ સ્થાન COVID-19 નાં પરિણામ સ્વરૂપે પડકારભર્યા સમયનો સામનો કરી રહ્યું હોવા છતાં, સીટી ઓફ બ્રમ્પટનની આજની ઘોષણા આ પડકારભર્યા સમય દરમિયાન બહુ જરૂરી રાહત પૂરી પાડવામાં મદદરૂપ થશે.”

- માર્કલ ગૌટ (Michael Gout), માલિક, સ્પોર્ટફિક્સ (SportFix)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca